

કઝાખસ્તાન 2025 સુધીમાં પોતાનું નામ બદલશે:

- મધ્ય એશીયાઈ દેશ કઝાખસ્તાન વર્ષ 2025 સુધીમાં પોતાનું નામ બદલીને કઝાકસ્તાન કરી દેશે.
- કઝાકસ્તાન વર્ષ 2025 સુધીમાં રશિયાઈ વર્ણમાળા સિરીલિક થી લેટીન વર્ણમાળામાં ફેરવાઈ જશે.

મહિલા એશિયા કપ હોકીમાં ભારતને ગોલ્ડ

- ભારતીય મહિલા હોકી ટીમે ધમાકેદાર પ્રદર્શન જાળવી રાખતાં રવિવારે રમાયેલી ફાઇનલમાં ચીનને પેનલ્ટી શૂટઆઉટમાં ૫-૪થી પરાજય આપી એશિયા કપ મહિલા હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે ભારતે આ ટૂર્નામેન્ટમાં ૧૩ વર્ષ બાદ ટાઇટલ જીત્યું હતું. ભારતીય મહિલા ટીમ છેલ્લે ૨૦૦૪માં ચેમ્પિયન બની હતી. ભારતીય ટીમે આ જીત સાથે પોતાના દમ પર આગામી વર્ષે ઇંગ્લેન્ડમાં યોજનાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ કરી લીધું છે.
- ભારતીય મહિલા હોકી ટીમે ટાઇટલ જીત્યું તે પહેલાં ગત મહિને ભારતીય પુરુષ ટીમે પણ મલેશિયાને હરાવી એશિયા હોકી કપનું ટાઇટલ જીત્યું હતું. આમ, એક જ વર્ષમાં મહિલા અને પુરુષ વિભાગમાં ચેમ્પિયન બનવા મામલે ભારતે કોરિયાની બરાબરી કરી હતી. કોરિયાની પુરુષ અને મહિલા ટીમોએ ૧૯૯૪માં ટાઇટલ જીત્યા હતાં.
- ત્રીજા સ્થાન માટે યોજાયેલી મેચમાં સાઉથ કોરિયાએ યજમાન જાપાનને ૧-૦થી પરાજય આપી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મલેશિયાએ થાઈલેન્ડ સામે ૪-૦થી જીત મેળવી પાંચમું સ્થાન મેળવ્યું હતું જ્યારે કઝાખસ્તાને સિંગાપુરને ૩-૦થી હરાવી સાતમું સ્થાન મેળવ્યું હતું.

એશિયાનો સૌથી મોટો પશુ મેળો સોનપુરમાં શરુ

- એશિયાનો સૌથી મોટો પશુ મેળો બિહારના સોનપુર ખાતે શરુ થઇ ગયો છે, જેનું ઉદઘાટન બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ કર્યું હતું.
- બિહાર વિષે થોડું જાણીએ:
- રાજધાની: પટના
- મુખ્યમંત્રી: નીતિશ કુમાર
- રાજ્યપાલ: સત્યપાલ મલિક
- ઉપ મુખ્યમંત્રી: સુશીલકુમાર મોદી

મુંબઇની 16 વર્ષની છોકરીએ વન ડે મેચમાં ફટકારી બેવડી સદી

- મુંબઇની જેમીમા રોડ્રિગેજે અન્ડર-19 વન ડે મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 163 બોલમાં 202 રનની ઇનિંગ્સ રમીને ઇતિહાસ રચ્યો હતો.
- 16 વર્ષિય જેમીમા ઔરંગાબાદમાં સૌરાષ્ટ્ર સામે 50 ઓવરની ઘરેલુ મેચમાં મુંબઇનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. માત્ર 13 વર્ષની વયે અન્ડર-19 ટીમમાં પ્રથમ વખત જગ્યા બનાવનાર જેમીમાએ આ ટૂર્નામેન્ટમાં બેવડી સદી ફટકારી હતી. તેની આ સદીની મદદથી મુંબઇએ 50 ઓવરમાં બે વિકેટ ગુમાવી 347 રન બનાવ્યા હતા. અન્ડર-19 સુપર લીગ મેચોમાં તેની એવરેજ 300થી ઉપર છે. જેમીમા અન્ડર-17 હોકીમાં પણ મુંબઇનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.

Join Our Telegram Channel: [Click Here](#)

Download Our Gk Application: [Click Here](#)